



**MBW-1601210502040502** Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. IV) (CBCS) Examination**

**April / May - 2018**

**Philosophy**

**(Philosophy of Phy. & Com.)**

**(New Course)**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

**સૂચના :** બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

- |   |
|---|
| <p>૧ કવોન્ટમ યંત્રશાસ્ત્રનું અનેક વિશ્વ અર્થઘટન ચર્ચો. <b>૧૪</b></p> <p style="text-align: center;"><b>અથવા</b></p> <p>૧ કવોન્ટમ ખગોળવિજ્ઞાનની મૂળભૂત સમસ્યા ચર્ચો. <b>૧૪</b></p><br><p>૨ સમગ્રતાના સિદ્ધાંત તરીકે સ્લિંગ થિયરી મૂલવો. <b>૧૪</b></p> <p style="text-align: center;"><b>અથવા</b></p> <p>૨ બિગબેંગ સિદ્ધાંત ચર્ચો. <b>૧૪</b></p><br><p>૩ વિશિષ્ટ સાપેક્ષવાદના લોરેન્ટ્ઝ રૂપાંતરણો ચર્ચો. <b>૧૪</b></p> <p style="text-align: center;"><b>અથવા</b></p> <p>૩ વ્યાપક સાપેક્ષવાદની અવકાશ, કાળ અને પદાર્થની સાપેક્ષતા ચર્ચો. <b>૧૪</b></p><br><p>૪ ન્યૂટનના ખગોળશાસ્ત્રના વિરોધાભાસ ચર્ચો. <b>૧૪</b></p> <p style="text-align: center;"><b>અથવા</b></p> <p>૪ કવોન્ટમ યંત્રશાસ્ત્રમાં કાર્યકારણ નિયમનું સ્વરૂપ ચર્ચો. <b>૧૪</b></p><br><p>૫ ટૂંકનોંધ : (કોઈ બે) <b>૧૪</b></p> <ul style="list-style-type: none"> <li>(૧) સુપરસીમેટ્રીનો જ્યાલ</li> <li>(૨) કવોન્ટમ યંત્રશાસ્ત્રનું કોપનહેગન અર્થઘટન</li> <li>(૩) ન્યૂટનનો નિરપેક્ષ અવકાશનો જ્યાલ</li> <li>(૪) ન્યૂટનનો નિરપેક્ષ સમયનો જ્યાલ.</li> </ul> |
|---|

## ENGLISH VERSION

**Instruction :** All questions carry equal marks.

- 1** Discuss the many world interpretation of quantum mechanics. **14**

**OR**

- 1** Discuss the basic problem of quantum cosmology. **14**

- 2** Evaluate string theory as a theory of everything. **14**

**OR**

- 2** Discuss bigbang theory. **14**

- 3** Discuss Lorentz transformation of special relativity. **14**

**OR**

- 3** Discuss the relativity of space, time and matter of general relativity. **14**

- 4** Discuss the paradox of Newtonian cosmology. **14**

**OR**

- 4** Discuss the law of causation in quantum mechanics. **14**

- 5** Write short note : (any two) **14**

- (1) Concept of super symmetri.
- (2) Copenhagen interpretation of quantum mechanics.
- (3) Newton's concept of absolute space.
- (4) Newton's concept of absolute time.

---